

## याकूबः पत्रं

I ईश्वरस्य प्रभो र्थीशुप्रीष्टस्य य द्दासो याकूब् विकीर्णीभूतान् द्वादशं वंशान् प्रति नमस्कृत्य पत्रं लिखति।

II हे मम भ्रातरः, यूयं यदा बहुविधपरीक्षाषु निपतत तदा तत् पूर्णानन्दस्य कारणं मन्यध्वां।

III यतो युष्माकं विश्वासस्य परीक्षितत्वेन धैर्यं सम्पाद्यत एति ज्ञानीथा।

IV तस्य धैर्यं सिद्धङ्गलं भवतु तेन यूयं सिद्धाः सम्पूर्णाश्च भविष्यथ कस्यापि गुणस्याभावश्च युष्माकं न भविष्यति।

V युष्माकं कस्यापि ज्ञानाभावो यदि भवेत् तर्हि य ईश्वरः सरलभावेन तिरस्कारञ्च विना सर्व्वेभ्यो ददाति ततः स यायतां ततस्तस्मै दायिष्यते।

VI किन्तु स निःसन्देहः सन् विश्वासेन यायतां यतः सन्दिग्धो मानवो वायुना यालितस्योत्प्लवमानस्य य समुद्रतरङ्गस्य सदृशो भवति।

VII तादृशो मानवः प्रभोः किञ्चित् प्राप्स्यतीति न मन्यतां।

VIII द्विमना लोकः सर्व्वगतिषु यञ्चलो भवति।

IX यो भ्राता नम्रः स निजोन्नत्या श्लाघतां।

X यश्च धनवान् स निजनम्रतया श्लाघतांयतः स तृणपुष्पवत् क्षयं गमिष्यति।

XI यतः सतापेन सूर्य्योर्णोदित्य तृणं शोष्यते तत्पुष्पञ्च भ्रश्यति तेन तस्य रूपस्य सौन्दर्य्यं नश्यति तद्द्रष्टुं धनिलोकोऽपि स्वीयमूढतया भ्लास्यति।

XII यो ज्ञनः परीक्षां सहते स अेव धन्यः, यतः परीक्षितत्वं प्राप्य स प्रभुना स्वप्रेमकारिभ्यः प्रतिज्ञातं श्रुवनमुकुटं लप्स्यते।

XIII ईश्वरो मां परीक्षत एति परीक्षासमये कोऽपि न वदतु यतः पापायेश्वरस्य परीक्षा न भवति स य क्मपि न परीक्षते।

XIV किन्तु यः कश्चित् स्वीयमनोवाग्छयाकृष्यते लोभ्यते य तस्यैव परीक्षा भवति।

XV तस्मात् सा मनोवाग्छा सगर्भा भूत्वा दृष्टृतिं प्रसूते दृष्टृतिश्च परिणामं गत्वा मृत्युं ज्ञनयति।

XVI हे मम प्रियभ्रातरः, यूयं न भ्राभ्यता।

XXVII यत् किञ्चिद् उत्तमं दानं पूर्णो वरश्च तत् सर्व्वम् उर्द्ध्वाद् अर्थतो यस्मिन् दृशान्तरं परिवर्तनजातच्छाया वा नास्ति तस्माद् दीप्याकरात् पितुरवरोडति।

XXVIII तस्य सृष्टवस्तूनां मध्ये वयं यत् प्रथमद्वलस्वत्पा भवामस्तदर्थं स स्वेच्छातः सत्यमतस्य वाक्येनास्मान् ज्ञनयामास।

XIX अतयेव हे मम प्रियभ्रातरः, युष्माकम् अकैको ज्ञनः श्रवणे त्वरितः कथने धीरः क्रोधेऽपि धीरो भवतु।

XX यतो मानवस्य क्रोध ईश्वरीयधर्मं न साधयति।

XXI अतो हेतो यूयं सर्व्वाम् अशुचिक्रियां दृष्टताढ्वाडुल्यञ्च निक्षिप्य युष्मन्नमसां परित्राणे समर्थं रोपितं वाक्यं नम्रभावेन गृह्णीता।

XXII अपरञ्च यूयं केवलम् आत्मवञ्चयितारो वाक्यस्य श्रोतारो न भवत किन्तु वाक्यस्य कर्मकारिणो भवता।

XXIII यतो यः कश्चिद् वाक्यस्य कर्मकारी न भूत्वा केवलं तस्य श्रोता भवति स दर्पणे स्वीयशारीरिकवदनं निरीक्षमाणास्य मनुजस्य सदृशः।

XXIV आत्माकारे दृष्टे स प्रस्थाय कीदृश आसीत् तत् तत्क्षणाद् विस्मरति।

XXV किन्तु यः कश्चित् नत्वा मुक्तेः सिद्धां व्यवस्थाम् आलोक्य तिष्ठति स विस्मृतियुक्तः श्रोता न भूत्वा कर्मकर्त्तैव सन् स्वकार्ये धन्यो भविष्यति।

XXVI अनायत्तरसनः सन् यः कश्चित् स्वमनो वञ्चयित्वा स्वं भक्तं मन्यते तस्य भक्तिर्मुधा भवति।

XXVII क्लेशकाले पितृहीनानां विधवानाञ्च यद् अवेक्षणं संसाराय्य निष्कलङ्गेन यद् आत्मरक्षणं तदेव पितुरीश्वरस्य साक्षात् शुचि निर्मला य भक्तिः।

## II

I હે મમ ભ્રાતરઃ, યૂયમ્ અસ્માકં તેજસ્વિનઃ પ્રભો યોશુષ્વીષ્ટસ્ય ધર્મં મુખાપેક્ષયા ન ધારયતી

II યતો યુષ્માકં સભાયાં સ્વર્ણાઙ્ગુરીયકયુક્તે ભ્રાજિષ્ણુપરિચ્છદે પુરુષે પ્રવિષ્ટે મલિનવસ્ત્રે કસ્મિંશ્ચિદ્ દરિદ્રેડપિ પ્રવિષ્ટે

III યૂયં યદિ તં ભ્રાજિષ્ણુપરિચ્છદવસાનં જનં નિરીક્ષ્ય વદેત ભવાન્ અત્રોત્તમસ્થાન ઉપવિશત્વિતિ કિંચ તં દરિદ્રં યદિ વદેત ત્વમ્ અમુસ્મિન્ સ્થાને તિષ્ઠ યદ્વાત્ર મમ પાદપીઠ ઉપવિશેતિ,

IV તર્હિ મનઃસુ વિશેષ્ય યૂયં કિં કુતર્કૈઃ કુવિચારકા ન ભવથ?

V હે મમ પ્રિયભ્રાતરઃ, શૃણુત, સંસારે યે દરિદ્રાસ્તાન્ ઈશ્વરો વિશ્વાસેન ધનિનઃ સ્વપ્રેમકારિભ્યશ્ચ પ્રતિશ્રુતસ્ય રાજ્યસ્યાધિકારિણઃ કર્તુ કિં ન વરીતવાન્? કિન્તુ દરિદ્રો યુષ્માભિરવજ્ઞાયતો

VI ધનવન્ત એવ કિં યુષ્માન્ નોપદ્રવન્તિ બલાચ્ચ વિચારાસનાનાં સમીપં ન નયન્તિ?

VII યુષ્મદુપરિ પરિકીર્તિતં પરમં નામ કિં તૈરેવ ન નિન્દ્યતે?

VIII કિંચ ત્વં સ્વસમીપવાસિનિ સ્વાત્મવત્ પ્રીયસ્વ, એતચ્છાસ્ત્રીયવચનાનુસારતો યદિ યૂયં રાજકીયવ્યવસ્થાં પાલયથ તર્હિ ભદ્રં કુરુથા

IX યદિ ચ મુખાપેક્ષાં કુરુથ તર્હિ પાપમ્ આચરથ વ્યવસ્થયા યાજ્ઞાલઙ્ગિન ઇવ દૂષ્યધ્વો

X યતો યઃ કશ્ચિત્ કૃત્સ્નાં વ્યવસ્થાં પાલયતિ સ યદ્યેકસ્મિન્ વિઘો સ્ખલતિ તર્હિ સર્વેષામ્ અપરાધી ભવતિ

XI યતો હેતોસ્ત્વં પરદારાન્ મા ગચ્છેતિ યઃ કથિતવાન્ સ એવ નરહત્યાં મા કુર્યા ઇત્યપિ કથિતવાન્ તસ્માત્ ત્વં પરદારાન્ ન ગત્વા યદિ નરહત્યાં કરોષિ તર્હિ વ્યવસ્થાલઙ્ગી ભવસિ

XII મુક્તે વ્યવસ્થાતો યેષાં વિચારેણ ભવિતવ્યં તાદૃશા લોકા ઇવ યૂયં કથાં કથયત કર્મ કુરુત ચા

XIII યો દયાં નાચરતિ તસ્ય વિચારો નિર્દયેન કારિષ્યતે, કિન્તુ દયા વિચારમ્ અભિભવિષ્યતિ

XIV હે મમ ભ્રાતરઃ, મમ પ્રત્યયોડસ્તીતિ યઃ કથયતિ તસ્ય કર્માણિ યદિ ન વિદ્યન્ત તર્હિ તેન કિં ફલં? તેન પ્રત્યયેન કિં તસ્ય પરિત્રાણં ભવિતું શકનોતિ?

XV કેષુચિદ્ ભ્રાતૃષુ ભગિનીષુ વા વસનહીનેષુ પ્રાત્યહિકાહારહીનેષુ ય સત્સુ યુષ્માકં કોડપિ તેભ્યઃ શરીરાર્થં પ્રયોજનીયાનિ દ્રવ્યાણિ ન દત્વા યદિ તાન્ વદેત્,

XVI યૂયં સકુશલં ગત્વોષ્ણગાત્રા ભવત તૃષ્યત ચેતિ તર્હોતેન કિં ફલં?

XVII તદ્દત્ પ્રત્યયો યદિ કર્મભિ ર્યુક્તો ન ભવેત્ તર્હોકાકિત્વાત્ મૃત એવાસ્તો

XVIII કિંચ કશ્ચિદ્ ઇદં વદિષ્યતિ તવ પ્રત્યયો વિદ્યતે મમ ય કર્માણિ વિદ્યન્તે, ત્વં કર્મહીનં સ્વપ્રત્યયં માં દર્શય તર્હાહમપિ મત્કર્મભ્યઃ સ્વપ્રત્યયં ત્વાં દર્શયિષ્યામિ

XIX એક ઈશ્વરો ડસ્તીતિ ત્વં પ્રત્યેષિ ભદ્રં કરોષિ ભૂતા અપિ તત્ પ્રતિયન્તિ કમ્પન્તે ચા

XX કિન્તુ હે નિબ્બોધમાનવ, કર્મહીનઃ પ્રત્યયો મૃત એવાસ્ત્યેતદ્ અવગન્તું કિમ્ ઇચ્છસિ?

XXI અસ્માકં પૂર્વપુરુષો ય ઇબ્રાહીમ્ સ્વપુત્રમ્ ઇસ્હાકં યજ્ઞવેદ્યામ્ ઉત્સૃષ્ટવાન્ સ કિં કર્મભ્યો ન સપુણ્યીકૃતઃ?

XXII પ્રત્યયે તસ્ય કર્મણાં સહકારિણિ જાતે કર્મભિઃ પ્રત્યયઃ સિદ્ધો ડભવત્ તત્ કિં પશ્યસિ?

XXIII ઇત્યન્નેદં શાસ્ત્રીયવચનં સફલમ્ અભવત્, ઇબ્રાહીમ્ પરમેશ્વરે વિશ્વસિતવાન્ તસ્ય તસ્ય પુણ્યાયાગણ્યત સ ચેશ્વરસ્ય મિત્ર ઇતિ નામ લબ્ધવાન્

XXIV પશ્યત માનવઃ કર્મભ્યઃ સપુણ્યીક્રિયતે ન ચૈકાકિના પ્રત્યયેના

XXV તદ્દદ્ યા રાહબ્નામિકા વારાઙ્ગના ચારાન્ અનુગૃહ્યાપરેણ માર્ગેણ વિસસર્જ સાપિ કિં કર્મભ્યો ન સપુણ્યીકૃતા?

XXVI અતએવાત્મહીનો દેહો યથા મૃતોડસ્તિ તથૈવ કર્મહીનઃ પ્રત્યયોડપિ મૃતોડસ્તિ

### III

I હે મમ ભ્રાતરઃ, શિક્ષકૈરસ્માભિ ગુરુતરદણ્ડો લપ્સ્યત ઇતિ જ્ઞાત્વા યૂયમ્ અનેકે શિક્ષકા મા ભવત।

II યતઃ સર્વે વયં બહુવિષયેષુ સ્ખલામઃ, યઃ કશ્ચિદ્ વાક્યે ન સ્ખલતિ સ સિદ્ધપુરુષઃ કૃત્સ્નં વશીકર્તુ સમર્થશ્ચાસ્તિ।

III પશ્યત વયમ્ અશ્વાન્ વશીકર્તુ તેષાં વકત્રેષુ ખલીનાન્ નિધાય તેષાં કૃત્સ્નં શરીરમ્ અનુવર્તયામઃ।

IV પશ્યત યે પોતા અતીવ બૃહદાકારાઃ પ્રચણ્ડવાતૈશ્ચ ચાલિતાસ્તેડપિ કર્ણધારસ્ય મનોડભિમતાદ્ અતિક્ષુદ્રેણ કર્ણેન વાગ્ધિતં સ્થાનં પ્રત્યનુવર્તન્તે।

V તદ્વદ્ રસનાપિ ક્ષુદ્રતરાઙ્ગં સન્તી દર્પવાક્યાનિ ભાષતે। પશ્ય કીદૃક્ષ્ણહારણ્યં દદ્યતે ડલ્પેન વહ્નિના।

VI રસનાપિ ભવેદ્ વહ્નિરધર્મરૂપપિષ્ટપો અસ્મદ્ગ્રેષુ રસના તાદૃશં સન્તિષ્ઠતિ સા કૃત્સ્નં દેહં કલક્ષ્યતિ સૃષ્ટિરથસ્ય ચક્રં પ્રજ્વલયતિ નરકાનલેન જ્વલતિ ચ।

VII પશુપક્ષ્યુરોગજલચરાણાં સર્વેષાં સ્વભાવો દમયિતું શક્યતે માનુષિકસ્વભાવેન દમયાઞ્ચક્રે ચ।

VIII કિન્તુ માનવાનાં કેનાપિ જિહ્વા દમયિતું ન શક્યતે સા ન નિવાર્યમ્ અનિષ્ટં હલાહલવિષેણ પૂર્ણા ચ।

IX તયા વયં પિતરમ્ ઈશ્વરં ધન્યં વદામઃ, તયા ચેશ્વરસ્ય સાદૃશ્યે સૃષ્ટાન્ માનવાન્ શપામઃ।

X એકસ્માદ્ વદનાદ્ ધન્યવાદશાપૌ નિર્ગચ્છતઃ। હે મમ ભ્રાતરઃ, એતાદૃશં ન કર્તવ્યં।

XI પ્રસ્રવણઃ કિમ્ એકસ્માત્ છિદ્રાત્ મિષ્ટં તિક્તઞ્ચ તોયં નિર્ગમયતિ?

XII હે મમ ભ્રાતરઃ, ઉડુમ્બરતરુઃ કિં જિતફલો દ્રાક્ષાલતા વા કિમ્ ઉડુમ્બરફલો કિલિતું શક્નોતિ? તદ્વદ્ એકઃ પ્રસ્રવણો લવણમિષ્ટે તોયે નિર્ગમયિતું ન શક્નોતિ।

XIII યુષ્માકં મધ્યે જ્ઞાની સુબોધશ્ચ ક આસ્તે? તસ્ય કર્માણિ જ્ઞાનમૂલકમૃદુતાયુક્તાનીતિ સદાચારાત્ સ પ્રમાણયતુ।

XIV किन्तु युष्मदन्तःकरणमध्ये यद्दि तिक्तेष्यां विवादेऽप्येव य विधते तर्हि सत्यमतस्य विरुद्धं न श्लाघध्वं नयानृतं कथयत।

XV तादृशं ज्ञानम् उर्ध्व्वाद् आगतं नहि किन्तु पार्थिवं शरीरि भौतिकञ्च।

XVI यतो हेतोरीष्यां विवादेऽप्येव य यत्र वेद्येते तत्रैव कलहः सर्व्वं दृष्टञ्च विधते।

XVII किन्तूर्ध्व्वाद् आगतं यत् ज्ञानं तत् प्रथमं शुचि ततः परं शान्तं क्षान्तम् आशुसन्धेयं द्यादिसत्कलैः परिपूर्णां असन्दिग्धं निष्कपटञ्च भवति।

XVIII शान्त्याचारिभिः शान्त्या धर्मकुलं रोप्यते।

## IV

I युष्माकं मध्ये समरा रणञ्च कुत उत्पद्यन्ते? युष्मदङ्गशिविराश्रिताभ्यः सुभेऽप्येव किं नोत्पद्यन्ते?

II यूयं वाञ्छथ किन्तु नाप्नुथ, यूयं नरहत्याम् र्थिष्याञ्च कुरुथ किन्तु कृतार्था भवितुं न शक्नुथ, यूयं युध्यथ रणं कुरुथ य किन्त्वप्राप्तास्तिष्ठथ, यतो हेतोः प्रार्थनां न कुरुथा।

III यूयं प्रार्थयध्वे किन्तु न लभध्वे यतो हेतोः स्वसुभभोगेषु व्ययार्थं कु प्रार्थयध्वे।

IV हे व्यभियारिणो व्यभियारिण्यश्च, संसारस्य यत् मैत्र्यं तद् र्थिष्वरस्य शात्रवमिति यूयं किं न ज्ञानीथ? अत एव यः कश्चित् संसारस्य मित्रं भवितुम् अभिलषति स एवेश्वरस्य शत्रु भवति।

V यूयं किं मन्यध्वे? शास्त्रस्य वाक्यं किं कुलडीनं भवेत्? अस्मदन्तर्वासी य आत्मा स वा किम् र्थिष्यार्थं प्रेम करोति?

VI तन्नहि किन्तु स प्रतुलं वरं वितरति तस्माद् उक्तमास्ते यथा, आत्माभिमानलोकानां विपक्षो भवतीश्वरः। किन्तु तेनैव नम्रेभ्यः प्रसादाद् दीयते वरः॥

VII अतएव यूयम् र्थिष्वरस्य वश्या भवत शयतानं संरुन्ध तेन स युष्मत्तः पलायिष्यते।

VIII ઈશ્વરસ્ય સમીપવર્તિનો ભવત તેન સ યુષ્માકં સમીપવર્તી ભવિષ્યતિ હે પાપિનઃ, યૂયં સ્વકરાન્ પરિષ્કુરુધ્વાં હે દ્વિમનોલોકાઃ, યૂયં સ્વાન્તઃકરણાનિ શુચીનિ કુરુધ્વાં

IX યૂયમ્ ઉદ્વિજ્ઞધ્વાં શોચત વિલપત ચ, યુષ્માકં હાસઃ શોકાય, આનન્દશ્ચ કાતરતાયૈ પરિવર્તતાં

X પ્રભોઃ સમક્ષં નમ્રા ભવત તસ્માત્ સ યુષ્માન્ ઉચ્ચીકરિષ્યતિ

XI હે ભ્રાતરઃ, યૂયં પરસ્પરં મા દૂષયતા યઃ કશ્ચિદ્ ભ્રાતરં દૂષયતિ ભ્રાતુ વિચારન્ કરોતિ સ વ્યવસ્થાં દૂષયતિ વ્યવસ્થાયાશ્ચ વિચારં કરોતિ ત્વં યદિ વ્યવસ્થાયા વિચારં કરોષિ તર્હિ વ્યવસ્થાપાલયિતા ન ભવસિ કિન્તુ વિચારયિતા ભવસિ

XII અદ્વિતીયો વ્યવસ્થાપકો વિચારયિતા ચ સ એવાસ્તે યો રક્ષિતું નાશયિતુન્ પારયતિ કિન્તુ કસ્ત્વં યત્ પરસ્ય વિચારં કરોષિ?

XIII અથ શ્વો વા વયમ્ અમુકનગરં ગત્વા તત્ર વર્ષમેકં યાપયન્તો વાણિજ્યં કરિષ્યામઃ લાભં પ્રાપ્સ્યામશ્ચેતિ કથાં ભાષમાણા યૂયમ્ ઇદાનીં શૃણુતા

XIV શ્વઃ કિં ઘટિષ્યતે તદ્ યૂયં ન જાનીથ યતો જીવનં વો ભવેત્ કીદૃક્ તત્તુ બાષ્પસ્વરૂપકં, ક્ષણમાત્રં ભવેદ્ દૃશ્યં લુપ્યતે ચ તતઃ પરં

XV તદનુકૃત્વા યુષ્માકમ્ ઇદં કથનીયં પ્રભોરિચ્છાતો વયં યદિ જીવામસ્તર્હ્યેતત્ કર્મ્મ તત્ કર્મ્મ વા કરિષ્યામ ઇતિ

XVI કિન્ત્વિદાનીં યૂયં ગર્વ્વવાક્યૈઃ શ્લાઘનં કુરુધ્વે તાદૃશં સર્વ્વં શ્લાઘનં કુત્સિતમેવા

XVII અતો યઃ કશ્ચિત્ સત્કર્મ્મ કર્ત્ત વિદિત્વા તન્ન કરોતિ તસ્ય પાપં જાયતે

## V

I હે ધનવન્તઃ, યૂયમ્ ઇદાનીં શૃણુત યુષ્માભિરાગમિષ્યત્કલેશહેતોઃ ક્ન્ધતાં વિલપ્યતાન્

II યુષ્માકં દ્રવિણં જીર્ણં કીટભુક્તાઃ સુચેલકાઃ

III कनकं रणतत्रापि विकृतिं प्रगमिष्यति, तत्कलङ्कश्च युष्माकं पापं प्रमाद्यिष्यति, हुताशवय्य युष्माकं पिशितं जाद्यिष्यति। एतथम् अन्तिमघस्त्रेषु युष्माभिः सञ्चितं धनं।

IV पश्यत येः कृषीवलैर्युष्माकं शस्यानि छिन्नानि तेभ्यो युष्माभि र्यद् वेतनं छिन्नं तद् उच्यैर्ध्वनिं करोति तेषां शस्यच्छेदकानाम् आर्त्तरावः सेनापतेः परमेश्वरस्य कर्णकुण्डरं प्रविष्टः।

V यूयं पृथिव्यां सुभभोगं कामुकताञ्चारितवन्तः, महाभोजस्य दिन एव निजान्तःकरणानि परितर्पितवन्तश्चा

VI अपरञ्च युष्माभिर्धार्मिकस्य दण्डाज्ञा इत्या याकारि तथापि स युष्मान् न प्रतिरुद्धवान्।

VII हे भ्रातरः, यूयं प्रभोरागमनं यावद् धैर्यमालम्ब्यं पश्यत कृषिवलो भूमेर्बहुमूल्यं कुलं प्रतीक्षमाणो यावत् प्रथमम् अन्तिमञ्च वृष्टिजलं न प्राप्नोति तावद् धैर्यम् आलम्बते।

VIII यूयमपि धैर्यमालम्ब्य स्वान्तःकरणानि स्थिरीकुरुत, यतः प्रभोरुपस्थितिः समीपवर्तिन्यभवत्।

IX हे भ्रातरः, यूयं यद् दण्ड्या न भवेत तदर्थं परस्परं न ग्लायत, पश्यत विचारयिता द्वारसमीपे तिष्ठति।

X हे मम भ्रातरः, ये भविष्यद्वादिनः प्रभोर्नाम्ना भाषितवन्तस्तान् यूयं दुःखसङ्घनस्य धैर्यस्य यद्दृष्टान्तान् ज्ञानीत।

XI पश्यत धैर्यशीला अस्माभिर्धन्या उच्यन्ते आयुषो धैर्यं युष्माभिरश्नावि प्रभोः परिणामश्चादर्शि यतः प्रभुर्बहुकृपः सकरुणश्चास्ति।

XII हे भ्रातरः विशेषत एदं वदामि स्वर्गस्य वा पृथिव्या वान्यवस्तुनो नाम गृहीत्वा युष्माभिः कोऽपि शपथो न क्रियतां, किन्तु यथा दण्ड्या न भवत तदर्थं युष्माकं तथैव तन्नहि येतिवाक्यं यथेष्टं भवतु।

XIII युष्माकं कश्चिद्दुःखी भवति? स प्रार्थनां करोतु। कश्चिद् वानन्दितो भवति? स गीतं गायतु।

XIV युष्माकं कश्चित् पीडितो ऽस्ति? स समितेः प्राचीनान् आह्वातु ते य प्रभोर्नाम्ना तं तैलेनाभिषिष्य तस्य कृते प्रार्थनां कुर्वन्तु।



XV તસ્માદ્ વિશ્વાસજાતપ્રાર્થનયા સ રોગી રક્ષાં યાસ્યતિ પ્રભુશ્ચ તમ્ ઉત્થાપયિષ્યતિ યદિ ચ કૃતપાપો ભવેત્ તર્હિ સ તં ક્ષમિષ્યતે।

XVI યૂયં પરસ્પરમ્ અપરાધાન્ અઙ્ગીકુરુધ્વમ્ આરોગ્યપ્રાપ્ત્યર્થઞ્ચૈકજનો ડન્યસ્ય કૃતે પ્રાર્થનાં કરોતુ ધાર્મિકસ્ય સયત્ના પ્રાર્થના બહુશક્તિવિશિષ્ટા ભવતિ।

XVII ય એલિયો વયમિવ સુખદુઃખભોગી મર્ત્ય આસીત્ સ પ્રાર્થનયાનાવૃષ્ટિં યાયિતવાન્ તેન દેશે સાર્દ્ધવત્સરત્રયં યાવદ્ વૃષ્ટિ ન બભૂવા।

XVIII પશ્ચાત્ તેન પુનઃ પ્રાર્થનાયાં કૃતાયામ્ આકાશસ્તોયાન્યવર્ષાત્ પૃથિવી ચ સ્વફલોદિ પ્રારોહયત્।

XIX હે ભ્રાતરઃ, યુષ્માકં કસ્મિંશ્ચિત્ સત્યમતાદ્ ભ્રષ્ટે યદિ કશ્ચિત્ તં પરાવર્તયતિ

XX તર્હિ યો જનઃ પાપિનં વિપથભ્રમણાત્ પરાવર્તયતિ સ તસ્યાત્માનં મૃત્યુત ઉદ્ધરિષ્યતિ બહુપાપાન્યાવરિષ્યતિ ચેતિ જાનાતુ।

## **Sanskrit Bible (NT) in Gujarati Script New Testament in Sanskrit Language; printed in Gujarati Script**

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit [SanskritBible.in](http://SanskritBible.in) to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

---

PDF generated using Haiola and XeLaTeX on 22 Feb 2024 from source files dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01